



Date: 18.07.2025

To,
The Manager,
Listing Department,
National Stock Exchange of India Limited
'Exchange Plaza', C- Block -G
Bandrakurla Complex, Bandra (East)
Mumbai - 400051

SYMBOL: SONAMLT

SUBJECT: PUBLICATION OF NEWSPAPER ADVERTISEMENT FOR THE 24TH ANNUAL GENERAL MEETING, E - VOTING AND BOOK CLOSURE DATE INFORMATION.

With reference to the above subject, please find enclosed herewith the copy of newspaper advertisement for the 24TH Annual General Meeting, Remote E - Voting information and Book Closure date published in the The Economic Times in English Edition and Navgujarat Samay in Gujarati Edition, dated July 18, 2025.

Kindly take same on your record.

Yours Sincerely,

For, SONAM LIMITED



MILANKUMAR SURESHBHAI GANATRA
COMPANY SECRETARY

Sonam Limited

Formerly known as Sonam Clock Limited

CIN : L33302GJ2001PLC039689

Registered Office : Survey No.337/P Morbi Rajkot Highway, At Lajai, Tal. Tankara, Dist. Morbi, Gujarat - 363641.
Phone : + 91 2822 285017, 9978052717 Fax : + 91 2822 285987. email : info@sonamquartz.com, url : www.sonamquartz.com

ET Panache

Royal steps
Prince Harry retraced Diana's 1997 Angola visit, walking through a live minefield to raise awareness

Savile Row and the women who demand a power suit

How the first women's tailoring label took up shop on the world's most famous street for men's clothing

Daisy Knatchbull first hit headlines in 2016 after assisting into Royal Ascot wearing a top hat, blue waistcoat, full morning coat with tails and six-inch Lookout heels.

Never mind that morning suits were traditionally the sartorial reserve of English gentlemen, Knatchbull — a great-granddaughter of Earl Mountbatten of Burma and a third cousin of Prince William — had ruffled society feathers, becoming the first woman to wear the event's signature outfit.

"It also made me realise," said Knatchbull, now 22, "that there was a serious appetite among women for bespoke tailoring and a suit-shaped gap for them on Savile Row."

Knatchbull started selling made-to-measure suits in 2019 with just four styles. Initially known as the Deck, then rebranded in 2024 as Knatchbull, it was the first women's tailoring label to take up shop on the world's



Daisy Knatchbull



Christine Schwarzen, wife of Blackstone billionaire Stephen, wears a black and white Knatchbull couture creation to the Met Gala this year

most famous street for men's clothing.

A state of decline
Changing tastes and a newswear and a decades long drift from formal wear, especially in the workplace, had left Savile Row in a state of perilous decline. The pandemic, with its elasticated waists and travel bans, further hurt the street's legendary tailors.

But Knatchbull believed that while the men's business may be struggling, more women than ever were willing to pay handsomely for a made-from-scratch suit designed for their bodies by experienced pattern cutters.

Just like their fathers, brothers and husbands may have done once upon a time. The difference? The staff of more than 100 are all women. "Our clients are served by women who have Savile Row training but really understand the changes a woman's body can go through, which most men don't," Knatchbull said. "If a client is undergoing fertility treatments, menopause, mastectomies,

menopause, mastectomies, or even sweating too much, we can listen to her and accommodate that with our garments."

Bespoke craftsmanship
Prices start at 3,000 pounds (\$4,400), for a made-to-measure suit, with at least three fittings over 12 to 14 weeks. After initial measurements, a client will choose her own fabric — the 7,000 options include velvets, corduroys, tartans and cashmeres — as well as the lining, buttons and monogramming for her suit.

Today, the company has a Rolodex of 2,500 clients whose orders can range from traditional powersuiting and three-piece looks to slouchy wide-legged pantsuits, old-school tuxedos, safari sets and jumpsuits. The first colour of choice is often navy. Most of those buying are professional women between 45 and 65, though the youngest client this far was 18 and the oldest was 88.

"I think people all over the world love the idea of English heritage and the bespoke craftsmanship of the Row," Knatchbull said. "Clients often say, 'I wish I had you when I started when I got my big promotion or had to sit next to my ex-husband at my daughter's graduation and needed to look hot.' They could go to many luxury brands, but they like how a Knatchbull suit makes them feel."

— The New York Times

Sold for \$30.5 mn! Young dinosaur steals the show

The largest piece of Mars ever found on Earth sold for just over \$5 million



ats Sotheby's auction of rare geological and archaeological objects in New York. But it was a rare young dinosaur skeleton that stole the show when it fetched more than \$30 million in a six-minute bidding frenzy.

The skeleton, believed to be from the late Jurassic period, carried a pre-auction estimate of \$4 million to

\$8 million. It is one of only four known Ceratosaurus skeletons and the only juvenile skeleton of the species, which resembles the T-rex but is smaller. Bidding for the skeleton started with a high advance offer of \$6 million, then escalated during the live round with bids \$500,000 higher than the last and

later \$1 million higher than the last, before ending at \$26 million (\$30.5 million with fees and costs). It was the third-highest amount paid for a dinosaur at auction. A Stegosaurus skeleton called 'Apex' holds the record after it was sold for \$44.6 million last year at Sotheby's.

— AP

Companies: Pursuit of Profit

Global Tenants Steer Warehousing Towards Path to Sustainability

Kailesh Babar

Mumbai: India's warehousing industry is witnessing a green transformation, driven not just by developers and investors but increasingly by multinational corporate occupiers whose global sustainability mandates are reshaping the market.

As companies tighten emissions targets, green-certified warehouses have moved from being a 'nice to have' to a 'must-have' in India's rapidly expanding logistics landscape, experts said. Led by this, India's certified green warehousing stock is expected to quadruple to 270 million square feet by 2030, up from 56 million square feet in 2024, showed data from JLL India. This underscores how global corporations are increasing demand towards sustainable, energy-efficient assets as part of their Net Zero strategies.

"Sustainability features such as green certifications, energy-efficient architecture, and advanced water management systems are no longer optional—they're essential for attracting and retaining high-quality, long-term occupiers. Global brands with ambitious ESG targets now prioritise assets that demonstrate strong environmental performance throughout their lifecycle, beyond mere location and cost," said Daniel Shah, CEO, India of Singapore-headquartered logistics platform L.O. COI Group. The share of green-certified space is expected to rise substantially as institutional players prioritise globally recognised standards like LEED, IGBC, and GRIHA to attract and retain marquee tenants.

"We believe that this shift towards green assets is not just good for the planet, it is smart business. Sustainable warehouses offer operational efficiencies, long-term savings, and future-proof value for both landlords and occupiers. The coming years will see a clear divide between assets that can meet these expectations and those that cannot," said Anshul Singhal, co-founder & MD, Welapure. Institutional players have understood that to have Multi-National Companies (MNCs) as tenants, their warehouses need to be Green and it is non-negotiable.

"India's green warehousing transformation is driven not only by institutional investors and developers but also by corporate occupiers' tenants. The Net Zero targets of most corporations are leading them to choose warehouse assets that are Green Certified," said Vignesh Shevade, head, Industrial & Logistics, India, JLL.

According to him, occupiers are targeting 30%-35% savings in energy consumption over the lifecycle of a project, alongside benefits such as water conservation, waste recycling, and the use of green materials.

Institutional investors have responded by ramping up supply of certified assets to meet this evolving demand. Institutional-grade warehousing space has already tripled to 99 million square feet in 2024 from 28 million square feet in 2019.

— The Economic Times

SONAM LIMITED

Reg. Office: Survey No. 337/p, Morbi Rajkot Highway, Lajal, Tal. Tankara, Dist. Morbi-363641
Contact No. +91 2822285017
Website: www.sonamquartz.com,
E-mail: info@sonamquartz.com
CIN: L33302GJ2001PLC039899

NOTICE OF 24th ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE

Notice is hereby given that the 24th Annual General Meeting (AGM) of the Members of SONAM LIMITED (Formerly known as Sonam Clock Limited) will be held on Tuesday, 12th August, 2025 at 04.00 P.M. IST through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) in accordance with the provisions of the Companies Act, 2013 and the Memorandum and Articles of Association of the Company.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

Members holding shares of the company as on Tuesday, 5th August, 2025, shall be eligible to vote in the AGM. The Members can join and participate in the 24th AGM through VC/OAVM facility only. The instruction for joining the 24th AGM and the manner of participation in the remote electronic voting or casting voting through e-voting system during the 24th AGM provided in the Notice of the 24th AGM. The E-voting period commences on Saturday, 9th August, 2025 at 9.30 A.M. IST and ends on Monday, 11th August, 2025 at 5.00 P.M. IST through remote electronic mode shall not be permitted beyond 05.00 P.M. IST.

THE TIMES OF INDIA

Registrations Close Today at 5:00 PM
Final Call: AI Bootcamp Starts Tomorrow

Future Forward

AI Bootcamp For Students
Make Your Child Future-Ready With AI

SCAN TO REGISTER

WhatsApp: +91 95605 00838
Website: https://toi.in/qC2vTb
Email: AIMasterclass@economictimes.com

POLYCAB

AHEAD OF THE CURVE.
BEYOND EXPECTATIONS.

At Polycab, progress is more than growth - It's about challenging limits, redefining standards, and setting new benchmarks.

With a sharp eye on the future and a culture built on excellence, agility, and innovation, we continue to expand horizons - across markets, categories, and expectations.

Even at scale, our performance remains ahead of the industry curve. Driven by multiple growth engines and an unrelenting pursuit of improvement, we are committed to creating long-term value for our customers, partners, and stakeholders.

(₹ in million)	Q1 FY26	Q1 FY25	Growth
Revenue	69,060	46,980	26%
Profit After Tax	5,997	4,016	49%

This is an unaudited representation of the unaudited consolidated results for the quarter ended 30th June 2025, and is not for the purpose of legal compliance. For full results, visit www.polycab.com or scan the QR code

f x in

